

અગ્નિપથ

વર્ષ : ૦૬ • અંક : ૦૮ • તંત્રી : હરીશ રાણા • સ્થાપક તંત્રી : અરવિંદ રાણા • તારીખ : ૦૧-૦૬-૨૦૧૭ ગુરુવાર • કિંમત : રૂ. ૧.૦૦ • પાના : ૪

વૈદિક સંસ્થાન, ઓઢવ દ્વારા આબુ પર્વત ખાતે સરળ આધ્યાત્મિક શિબિર યોજાઈ ગઈ



વૈદિક સંસ્થાન, ઓઢવ દ્વારા ગત તા. ૧૯ થી ૨૧ મી મે, ૨૦૧૭ દરમ્યાન સરળ આધ્યાત્મિક શિબિર યોજવામાં આવી હતી. રાજસ્થાનનાં રમણીય આબુ પર્વત ઉપર આ શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

વૈદિક સંસ્થાનનાં પ્રમુખ શ્રી પ્રફુલભાઈ વોરાએ અગ્નિપથ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આર્યજગતનાં સુપ્રસિદ્ધ દાર્શનિક સંન્યાસી સ્વામી

વિવેકાનંદજી પરિવ્રાજકના સાનિધ્યમાં આ શિબિર યોજવામાં આવી હતી.

આ શિબિરમાં અમદાવાદ, ગાંધીનગર, ભરુચ, રાજકોટ સહિત દિલ્હી અને રાજસ્થાનનાં ૧૭૦ થી વધુ ધર્મપ્રેમી સજ્જનો અને સંસ્ત્રાીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અહીં વાતાવરણ પ્રમાણમાં ઓછું ગરમ હોવાથી શિબિરાર્થીઓમાં શિબિર માણવાનો તથા બે કલાક આબુ ભ્રમણનો આનંદ સ્પષ્ટ

પણ જોવા મળતો હતો. શિબિરમાં સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી રચીત આર્યોદિશ્ય રત્નમાલા, ધ્યાન યોગ પ્રશિક્ષણ, કર્મફળ સિદ્ધાંત અને આત્મનિરીક્ષણનાં વર્ગોની સાથે શંકાસમાધાનનાં વર્ગનું પણ સંચાલન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં દૈનિક ભાસ્કર ગૃપનાં એમડી તથા દર્શન યોગ મહાવિદ્યાલયની સફળતા વિજ્ઞાન પરિયોજનાનાં



અધ્યક્ષ શ્રી જગદીશજી શર્મા જ્ઞાનવર્ધક વ્યાખ્યાન આપવામાં દ્વારા લાઈફ મેનેજમેન્ટ ઉપર (અનુ. પાન-૩ ઉપર)

આર્યસમાજ, આણંદ ખાતે આર્ય વીરાંગના શિબિર સંપન્ન

ચરોતર પ્રદેશ આર્યસમાજ, આણંદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત આર્યસમાજની યુવા પાંખ આર્યવીર દળ-ગુજરાત દ્વારા ગ્રીષ્મકાલીન વાર્ષિક ચરિત્ર નિર્માણ શિબિરનું આયોજન દર વર્ષે મે માસમાં કરવામાં આવે છે. જેમાં ધર્મ-સંપ્રદાય-જાત પાતનાં ભેદભાવ વિના ૧૩ થી ૨૦ વર્ષની વયજુથની યુવતિઓ માટે “આર્ય વીરાંગના દળ શિબિર” (બહેનો માટે) આ વર્ષે તા. ૧૪-૫-૨૦૧૭ થી તા. ૨૧-૫-૨૦૧૭ સુધી ચરોતર પ્રદેશ આર્યસમાજ, આણંદ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતભરનાં આર્યસમાજો તરફથી આશરે ૧૦૦ જેટલી

બહેનોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં શારીરિક-બૌદ્ધિક અને આધ્યાત્મિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં ઉષ્મા પ્રેરક વ્યાયામ, દંડ બેઠક, આસન, સૂર્યનમસ્કાર, લાઠી, કરાટે, સ્વ-બચાવ વગેરેની તાલીમ તેમજ આરોગ્ય જાળવણી, રાષ્ટ્રીય ભાવના પ્રેરક અને વૈદિક ધર્મ પરિચયનું બૌદ્ધિક પ્રશિક્ષણ તથા યજ્ઞ અને પર્યાવરણ બચાવવાની તાલીમ આપવામાં આવી હતી.

આ શિબિરમાં સવારે ૪-૩૦ વાગ્યાથી રાત્રિના ૯-૪૫ સુધીની દિનચર્યા હતી. આ શિબિરમાં તા. ૧૫-૫-૨૦૧૭ થી ૧૮-૫-૨૦૧૭ દરમ્યાન વિવિધ નિષ્ણાતો દ્વારા યુવતિઓને બૌદ્ધિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં



પંદર વર્ષથી નાની ઉંમરની બાળકીઓની યાદશક્તિ, ઋણશક્તિ વધે તે માટે પાવર ઓફ માર્ડનની ચાર દિવસની તાલીમ ગાંધીનગરથી આવેલા

શ્રી અરવિંદભાઈ રાણાએ આપી હતી. ગેસ સેફ્ટી સેમીનાર રાજન ગેસ સર્વિસ, આણંદનાં પ્રોપરાઈટર શ્રી અશોકભાઈ

પટેલ દ્વારા યોજવામાં આવ્યો હતો. મહિલા સુરક્ષા તથા સમાજમાં મહિલાઓને પડતી મુશ્કેલીના નિવારણ અંગેની (અનુ. પાન-૩ ઉપર)

યોગની સાચી પરિભાષાને પુનઃ પ્રચલિત કરવી અત્યંત જરૂરી છે

આગામી ૨૧મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આસન-પ્રાણાયામ એટલે જ યોગ એવી પ્રબળ માન્યતાઓ સાથે વર્તમાન સમયમાં યોગની નવી પરિભાષા પ્રચલિત થઈ ગઈ છે. સ્વામી રામદેવજીએ યોગને પ્રચલિત તો કરી દીધો પણ તેમણે યોગને માત્ર સ્વાસ્થ્ય રક્ષા પૂરતો સિમિત કરી દીધો છે. આજે દેશ વિદેશમાં યોગ એટલે આસન, પ્રાણાયામ અને આંશિકરૂપે ધ્યાન એવી માન્યતા ઘર કરી ગઈ છે.

મહર્ષિ પતંજલિ મુજબ યોગ એટલે સમાધિ. ઈશ્વર પ્રાપ્તિ કરીને અવિદ્યાના સંસ્કારોને દગ્ધબીજ કરવાની વિદ્યા એટલે યોગ. મનની વૃત્તિઓને રોકવાની વિદ્યા એટલે યોગ. મહર્ષિ પતંજલિનો આ સમાધિ પ્રાપ્તિ સુધી આઠ અંગોનું અનુષ્ઠાન કરવાનું જ્ઞાન પીરસતો યોગ અત્યારે વિસરાઈ ગયો છે. યોગની સાચી પરિભાષાને પુનઃ પ્રચલિત કરવી અત્યંત જરૂરી છે.

સંપાદકીય.. - અરવિંદ રાણા

અત્યારે જરૂર છે યોગના સાચા સ્વરૂપને લોકો સમક્ષ મૂકવાની. યોગના નામે આસન-પ્રાણાયામનું પ્રશિક્ષણ ઠેર ઠેર આપવામાં આવે છે. આસન-પ્રાણાયામના અભ્યાસથી લોકોને સ્વાસ્થ્ય લાભ તો અવશ્ય થાય છે. પરંતુ યોગના વાસ્તવિક આધ્યાત્મિક લાભથી લોકો વંચિત રહી જાય છે. વળી, આવું સતત ચાલતું રહેશે તો મહર્ષિ પતંજલિનાં યોગને સ્થાને સ્વામી રામદેવજી દ્વારા પ્રચલિત યોગને જ લોકો પ્રાચીન યોગ વિદ્યા સમજવા માંડશે. આવું ન બને તે માટે જ્યાં જ્યાં યોગના નામે આસન-પ્રાણાયામનાં કેન્દ્રો ચાલે છે ત્યાં જઈને સંચાલકને વિશ્વાસમાં લીધા પછી ધીમે ધીમે યોગ દર્શનના સૂત્રોનું પઠન-પાઠન શરૂ થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ.

ખાસ કરીને સ્વામી રામદેવજીના શિષ્યોમાં મહર્ષિ પતંજલિનાં યોગ શાસ્ત્રને જાણવાની જિજ્ઞાસા જોવા મળે છે ત્યારે તેમનો સંપર્ક સાધી લોકોને સ્વાસ્થ્ય લાભ માટે આસનો કરતા રહેવાની પ્રેરણા આપી સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ માટે મહર્ષિ પતંજલિ દ્વારા નિર્દિષ્ટ માર્ગ ક્રિયાત્મકરૂપે ધ્યાનનો અભ્યાસ કરવા પ્રેરણા આપી તેમને પણ આધ્યાત્મિક માર્ગમાં સાથે જોડવાનો પ્રયત્ન થાય તે જરૂરી છે. આ માટે વૈદિક દાર્શનિક વિદ્વાનોએ ગંભીરતાપૂર્વક પ્રયત્નો કરવાની જરૂર છે.

આર્યસમાજનાં.. (પાન-જનું શેષ)

ધર્મમાં સંમિલિત કરાવવાના આ ષડયંત્રનો ભાંડાફોડ ઉદ્ઘાટનનાં કાર્યક્રમમાં નિમંત્રિત રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનની સમક્ષ કરીને તેમને તે કાર્યક્રમમાં ન જવા સંમત કરેલ. તેમજ શાસ્ત્રીજી આ કાર્યક્રમની અધ્યક્ષતા કરનાર હતા તે પણ નિરસ્ત કરાવેલ.

આમ, બહુમુખી પ્રતિભાના ધની, વ્યક્તિગત સ્તરે સંસ્કૃત તેમજ વૈદિક સંસ્કૃતિના વિદ્વાન, વ્યવસાયમાં અગ્રણી, સમાજ તેમજ શ સેવામાં તન, મન, ધનથી સમર્પિત, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર

પ્રભાવોત્પાદક દાનવીર પ્રતાપસિંહજી શૂરજી વલ્લભદાસના નિધનથી આર્યસમાજ તેમજ અનેક સામાજિક સંગઠનોને અપૂરણીય ક્ષતિ થઈ છે. તેમનાં બહુમૂલ્ય પ્રદાન બદલ સમાજ ઋણી છે.

તેઓ શ્રીને દર્શનયોગ મહાવિદ્યાલય, આર્યવન-રોજડ પરિવાર વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને તેમના દ્વારા પ્રસ્થાપિત પરંપરાઓ તેમના પરિવાર, સમાજ અને સુગઠનોમાં નિર્બાધરૂપે ચાલતી રહે તેવી પરમ પિતા પરમાત્માને અભ્યર્થના કરે છે. (દિનેશકુમાર, વ્યવસ્થાપક-દર્શનયોગ મહાવિદ્યાલય, આર્યવન-રોજડ)

લક્ષ્ય પ્રાપ્તિ માટે કરવા પડતા કાર્યોને ભરપૂર સમય આપવો અનિવાર્ય છે

સમય બહુ મૂલ્યવાન છે. કોઈપણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો માણસે સમયનાં મૂલ્યને સમજવું જ રહ્યું. લોકો કહે છે કે

Time is money. વાત તો સાચી જ છે કે માણસ પોતાના સમયને અર્થ ઉપાર્જનમાં લગાવી દે તો તે એ સમયના બદલામાં ધન કમાઈ શકે છે. પરંતુ હું એનાથી પણ એક ડગલું આગળ વધીને કહેવા માંગુ છું કે Time is more precious than money. સમય ધન કરતાં પણ વધારે કિંમતી છે. એક વાર કમાયેલું ધન છીનવાઈ જાય તો ફરીથી કમાઈ શકાય છે. પરંતુ એક વાર હાથમાંથી નીકળી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. માટે સમય ધન કરતાં પણ વધારે કિંમતી છે એ વાત આપણે ન ભૂલવી જોઈએ.

બુદ્ધિમાન વ્યક્તિ જ્યારથી સમજણો જાય છે ત્યારથી મૃત્યુ પર્યંત કોઈને કોઈ ઉદ્દેશ્યને, લક્ષ્યને સામે રાખીને જીવન જીવતો હોય છે. ઉંમરની અલગ અલગ અવસ્થામાં લક્ષ્ય પણ અલગ અલગ હોય છે. પરંતુ તે લક્ષ્યને પ્રાપ્ત કરવાના સાધનોનો ઉપયોગ કરવાની વિધિ લગભગ સમાન જ હોય છે. લક્ષ્યની પ્રાપ્તિમાં શ્રદ્ધા હોવી, લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરવો અર્થાત તે દિશામાં મહેનત કરવી જરૂરી છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે કરવા પડતા કાર્યોને ભરપૂર સમય આપવો અનિવાર્ય છે.

સમયસર કામ પૂરું ન થાય તો તેમાં સફળતા મળતી નથી અથવા આંશિક સફળતા જ મળે છે. જો પૂર્ણ સફળ થવું હોય તો તેના માટે અનેક કાર્યોનું વિધિવત સંપાદન કરવું પડે છે અને તેમાંનું એક છે સમયનું પાલન.

સમયનું સમાયોજન માણસને કઠીનમાં કઠીન કાર્યને સમયસર પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમયની બાબતમાં માણસે એ બાબતનું પણ પરિક્ષણ કરી લેવું જોઈએ કે જાગૃતકાળમાં તે ક્યા સમયે સૌથી વધારે તાજગીનો અનુભવ કરે છે. આ સમય બધાનો એક સરખો હોય તેવું

જો પૂર્ણ સફળ થવું હોય તો તેના માટે અનેક કાર્યોનું વિધિવત સંપાદન કરવું પડે છે અને તેમાંનું એક છે સમયનું પાલન.

જરૂરી નથી. માટે થોડા દિવસોનાં પરિક્ષણમાં માણસને ખ્યાલ આવી જાય છે કે તે ક્યારે સૌથી વધારે તાજગીનો અનુભવ કરે છે. આવા સ્ફૂર્તિવાળા સમયનો ઉપયોગ આપણે કઠીન વિષયોને સમજવામાં કરવો જોઈએ. કોઈ ગંભીર સમસ્યા હોય, કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય, કોઈ મહત્વનું અને ખૂબ ચિવટથી, ધ્યાનથી કરવું પડે તેવું કાર્ય હોય તો તે કામને આવા

વ્યાયામ, આસન વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. પછી સ્નાન બાદ ઓછામાં ઓછું પાંચ-દસ મિનિટ ધ્યાન કરી અઘરા વિષયો સમજવાનો પ્રયત્ન કરીશું તો વધારે સારી સફળતા મળશે. સવારે નાસ્તો કરીને અડધા કલાક બાદ પણ મન શાંત, સ્વસ્થ, પ્રકૃતિલિલ હોવાથી ઝડપથી એકાગ્ર કરી શકાય છે માટે આવા સમયે પણ મહત્વપૂર્ણ કાર્યો કરી શકાય.

દરેક વ્યક્તિએ પછી તે વિદ્યાર્થી હોય કે ગૃહસ્થી, વેપારી હોય કે અધિકારી; તેણે સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધીના સમયનું પ્લાનીંગ કરી લેવું જોઈએ. દરેક કાર્ય તેના સમયે થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ. આદર્શ દિનચર્યા બનાવી તેનું પાલન કરતા રહેવાથી વ્યક્તિ ઝડપથી સફળતા તરફ અગ્રેસર થાય છે. સફળતાનો આ મંત્ર બહુ મહત્વનો છે કે ભરપૂર સમય લગાવી ભરપૂર સફળતા પ્રાપ્ત કરો. (ક્રમશઃ)




સમયે કરવું જોઈએ.

આ ઉપરાંત સમયસર સુઈને સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવામાં આવે તો સવારનો સમય પણ કઠિન કાર્યો માટે ફાળવીને લાભ ઉઠાવી શકાય છે. હાં, વહેલા ઉઠીને આળસ ન આવવી જોઈએ. ઉઠ્યા પછી શૌચ બાદ ખુલ્લામાં થોડું ભ્રમણ,

દર્શન યોગ મહાવિદ્યાલય દ્વારા “ચિંતન કે ક્ષણ” પુસ્તક પ્રકાશિત કરવામાં આવી

આર્યજગતનાં સુપ્રસિદ્ધ દાર્શનિક વિદ્વાન આચાર્ય સત્યજિતજી આર્ય દ્વારા લિખિત ચિંતન કે ક્ષણ પુસ્તક દર્શન યોગ મહાવિદ્યાલય, રોજડ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આ લઘુ પુસ્તક એવા પ્રેરક વાક્યોનો સંગ્રહ છે જેના ઉપર ચિંતન કરવામાં આવે તો સ્વયંના જીવનને આધ્યાત્મિક ક્ષેત્રે ઉન્નત બનાવવામાં વ્યક્તિ સમર્થ બની જાય. આ પુસ્તકના સંકલન તથા સંપાદનનું કાર્ય ડો. રાધાવલ્લભ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે.



અગ્નિપથનું લવાજમ સીધું બેંકમાં ભરો
 આપ નીચેના બેંક એકાઉન્ટમાં વાર્ષિક લવાજમ પેટે સહયોગ રાશી રૂ. ૨૦૦/- ભરી તેની અગ્નિપથને મોબા. ૯૭૨૭૭ ૦૦૨૦૮ ઉપર જાણ કરી શકો છો.
ખાતાનું નામ : અગ્નિપથ બેંક : યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા
શાખા : ગાંધીનગર, કરન્ટ એકાઉન્ટ નં. ૧૪૫૫૦૫૦૦૦૩૬૮૧

દાતણ કે બ્રશ કર્યા પછી ગરમ પાણીના ૧૦ થી ૧૨ કોગળા કરવા જોઈએ

માનવ શરીર જુદા જુદા ઘણા અંગોનું બનેલું છે. દરેક અંગ એક નિશ્ચિત કાર્ય કરે છે. જેમ કોઈપણ યંત્ર પાસે જેટલું વધારે કામ લેવું હોય તેમ તેની એટલી જ કાળજી વધારે લેવી જોઈએ. એજરીતે આ શરીરરૂપી યંત્રને પણ લાંબો સમય સ્વસ્થ ટકાવી રાખવા માટે એની પણ સંભાળ વધુ રાખવી જરૂરી છે. એના માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાનું વિસ્તૃત વર્ણન કરેલું છે. આજે લોકો પોતાના ચહેરા અને વાળની સંભાળ રાખવા જેટલા પૈસા અને સમય ખર્ચે છે તેટલા બીજા અંગોની સંભાળ માટે ખર્ચતા નથી પરંતુ મનુષ્યના દરેક અંગનું પોતાનું અલગ મહત્વ છે. એક અંગનું કાર્ય બીજું કોઈ અંગ કરી શકવાનું નથી. આજ રીતે સારવારમાં ઉપેક્ષા સેવાતુ એક અંગ એટલે મુખમાં આવેલા દાંત.

મનુષ્યના સમગ્ર જીવનકાળ દરમ્યાન બે વાર દાંત આવે છે. બાલ્યકાળમાં પ્રથમ આવતા દાંતને દૂધિયા દાંત કહે છે. જેની સંખ્યા ૨૦ હોય છે અને કમ્શ: તે પડી જાય છે. પછી ઉડા

મૂળવાળા ૩૨ કાયમી દાંત આવે છે. જેનું આયુષ્ય મનુષ્યની જાળવણી ઉપર રહેલું છે. માટે દાંતની સાર સંભાળ રાખવી જરૂરી બને છે. તેના માટે આપણે નીચેની વાતોને ધ્યાનમાં રાખી તેનું પાલન કરવું જોઈએ.

લોકોને પ્રશ્ન થાય છે કે દાતણ કરવું કે બ્રશ? જો બંનેની સગવડ હોય તો દાતણને અગ્રતા



આયુર્વેદામૃતમ..

વેદ જીવેશ પટેલ-આર્યગામ, રાંલેખ

આપો. કારણ કે આયુર્વેદમાં લીમડો, કણજી, મહુડો, ખેર વગેરેના દાતણ વાપરવાનો ઉલ્લેખ છે. જે દાંત અને પેદાંને જોડવાનું કાર્ય કરે છે. દાંતણ ૧૨ આંગળી જેટલું લાંબુ હોવું જોઈએ અને સવાર તથા સાંજ બંને સમયે

દાતણ કે બ્રશ કર્યા બાદ ગરમ પાણીને મોઢામા પૂરેપૂરું ભરી રાખીને થોડીવાર પછી થૂંકી દેવું તેને 'ગન્ડૂષ' કહે છે.

આગળના ભાગનો કુચો કરી પછી એક-એક દાંતને સારી રીતે અંદર તેમજ બહારથી સાફ કરતા દાતણ કરવું જોઈએ.

જો બ્રશ કરવું હોય તો બ્રશ સાથે ઘસવા માટે આયુર્વેદિક

ખીલી પર ખુલ્લું ટીંગાળવું જોઈએ. જેથી તેમાં ભીનાશ ન રહે. જો ભીનાશ હોય તો તેમાં જીવાણુઓની વૃદ્ધિ થાય છે. બ્રશને ૪-૫ મહિને બદલી નાંખવું જોઈએ. બ્રશના દાંતા કડક ન હોવા જોઈએ. જો કડક હશે તો પેદા પર વાગશે અને તેને નુકશાન પહોંચાડશે.

દાતણ કે બ્રશ કર્યા પછી ગરમ પાણીના ૧૦-૧૨ કોગળા કરવા જોઈએ તથા ગરમ પાણીને મોઢામા પૂરેપૂરું ભરી રાખીને થોડીવાર પછી થૂંકી દેવું તેને 'ગન્ડૂષ' કહે છે. જેનો પ્રયોગ ૩-૪ વાર કરવો. (કમ્શ:)

વેદિક સંસ્થાન...

(પાન-૧નું શેષ)

આવ્યું હતું. આ ઉપરાંત આખું પર્વત ઉપર સ્થિત આર્ષ ગુરુકુળનાં આચાર્ય શ્રી ઓમપ્રકાશજી દ્વારા સવારે આસન, વ્યાયામ અને પ્રાણાયામનું ક્રિયાત્મક પ્રશિક્ષણ

આપવામાં આવ્યું હતું. એક દિવસ સાંજની સંધ્યા આર્ષ ગુરુકુળનાં પ્રાકૃતિક રમણીય સ્થળે ગુરુકુળનાં ભ્રમચારીઓ દ્વારા કરાવવામાં આવેલ.

આધ્યાત્મિક ક્ષેત્રે બુદ્ધિજીવી લોકો મા અનેક પ્રકારની શંકાઓ હોય છે જે

સ્વાભાવિક જ છે. આ શિબિર દરમ્યાન અનેક જિજ્ઞાસુઓની શંકાઓનું સ્વામીજી દ્વારા શાસ્ત્રોક્ત અને તાર્કિકરીતે સમાધાન કરાયું હતું.

સમગ્ર શિબિર દરમ્યાન કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી લાલચંદભાઈ આર્ચ દ્વારા

આર્યસમાજ....

(પાન-૧નું શેષ)

સમજ આપવા જાગૃત મહિલા સંગઠનનાં પ્રમુખ શ્રીમતી આશાબહેન દલાલે ઉપસ્થિત રહી ઉડાણપૂર્વક સમજ આપી હતી. સ્ત્રી રોગો તથા તરૂણાવસ્થામાં યુવતિઓ-બાળકીઓને થતા શારીરિક, માનસિક રોગો અંગેની સમજણ તથા તેના નિવારણ માટે શું કરવું જોઈએ - કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની માહિતી આપવા માટે હોમિયોપેથિક કોલેજ આણંદનાં સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉ. હિનાબહેન આર. પટેલ (એમડી) તથા ડૉ. વી. એચ. દવે ઉપસ્થિત રહ્યાં હતા.

આર્ય વીરાંગના દળ શિબિરનું સમગ્ર સંચાલન શ્રી હસમુખભાઈ પરમાર-ટંકારાના અધ્યક્ષતામાં તથા સંસ્થાના પ્રમુખ શ્રી કનકસિંહજી વાઘેલા તથા મંત્રી આર્કિ. શ્રી અશોકભાઈ પટેલ તથા અંતરંગ સભ્યોના સક્રિય સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પ્રફલભાઈ વોરા, શ્રી રાજકુમારજી યાદવ, શ્રી દિનેશભાઈ શાહ, શ્રી સંજયભાઈ પ્રજાપતિ, શ્રી લાલચંદભાઈ આર્ચ સહિત અનેક મહાનુભાવોએ પ્રસંશનીય કામગીરી કરી હતી.

આર્યસમાજ-પોરબંદર

જાહેર સૂચના

આર્યસમાજ પોરબંદરના બંને પુરોહિત કૃષ્ણકાંત તથા શિવકુમાર શાસ્ત્રીને ઝઘડાઓ કરતા હોવાની ફરીયાદ અને હવન યજ્ઞ / સંસ્કારો કરાવનાર યજમાન સદ ગૃહસ્થીઓ પાસેથી સંસ્થાએ નક્કી કરી આપેલ દક્ષિણા ઉપરાંત હવન કરાવનાર યજમાન પાસેથી ઈચ્છાનુસાર વધુ પડતી દક્ષિણા માંગતા હોવાની ફરીયાદો અવાર-નવાર આવતી હોવાથી બંને પંડિતોના કારણે સંસ્થાની છબી ઉપર ઝાક ન લાગે તેથી સંસ્થા અને લોકોની ફરીયાદોને ધ્યાને રાખી તુરંતની અસરથી બંને પંડિત કૃષ્ણકાંત તથા શિવકુમાર શાસ્ત્રીને તા. ૧૫-૬-૨૦૧૬થી આર્ય સમાજ પોરબંદરમાંથી છુટા કરી દીધેલ છે.

અમારા ધ્યાન ઉપર આવેલ છે કે ઉપર જણાવેલ બંને પંડિતો આર્યસમાજની વૈદિક વિધિથી હવન-યજ્ઞ તથા અન્ય વૈદિક સંસ્કારો કરીને આર્યસમાજ પોરબંદરને આર્થિક નુકશાન પહોંચાડી રહેલ છે.

આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે પુરોહિત કૃષ્ણકાંત તથા શિવકુમાર શાસ્ત્રી આર્યસમાજ પોરબંદરના નામે કોઈ પ્રવૃત્તિ હવન-યજ્ઞ કે કોઈ વૈદિક સંસ્કાર કરાવે તેમાં આર્યસમાજ પોરબંદરની સહમતિ બિલકુલ નથી. આમ છતાં કોઈ જાહેર જનતા તેઓની પાસે હવન-યજ્ઞ કે વૈદિક સંસ્કારો કરાવવાથી કોઈને થનાર આર્થિક-સામાજિક કે ધાર્મિક હાની માટે આર્યસમાજ પોરબંદર જવાબદાર રહેશે નહીં.

આ બાબતની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.

નોંધ : હાલ આર્યસમાજ પોરબંદરમાં બે પંડિત કાર્યરત છે. ૧) બ્રહ્માનંદ 'આઝાદ' (ગોડા) તથા ૨) કમલેશ શાસ્ત્રી (અંબાલા) અને ત્રીજા પંડિત સૂર્યકાંત સુમન આવવાની શક્યતા છે.

પ્રમુખશ્રી

આર્યસમાજ, પોરબંદર

મંત્રીશ્રી

આર્યસમાજ, પોરબંદર

આર્ય વીરાંગનાઓએ શિબિર દરમ્યાન દિવ્ય દૃષ્ટિ જાગૃત કરી લીધી



આર્ય વીરાંગના દળની શિબિર દરમ્યાન પ્રારંભનાં ચાર દિવસો સુધી રાત્રિકાલિન મનોરંજનના સત્રમાં દિવ્ય દૃષ્ટિ જાગૃતનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં પસંદ કરેલી ૧૫ જેટલી વીરાંગનાઓએ માત્ર પાંચ કલાકનાં પ્રશિક્ષણમાં પીનીયલ ગ્લેન્ડનાં માધ્યમથી આંખો બંધ હોવા છતાં વસ્તુ ઓળખવાની, કલર ઓળખવાની, લખેલું વાંચવાની યોગ્યતા મેળવી લીધી હતી.

ગાંધીનગરથી શ્રી અરવિંદભાઈ રાણા આ પ્રશિક્ષણ આપવા ખાસ આણંદ આવ્યા હતા. કાર્યક્રમનાં સમાપન પ્રસંગે મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અનેક વીરાંગનાઓએ નિદર્શન કરી ઉપસ્થિત જનસમુદાયને આશ્ચર્યચકિત કરી દીધો હતો.

વૈદિક વીરાંગના દળ દ્વારા બેટી બચાવોના સંદેશની પ્રદર્શની સાથે જયપુર ખાતે બેટી બચાવો વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા તથા બેટી ફોક પ્રતિયોગિતા યોજાઈ ગઈ



જયપુર સ્થિત વૈદિક વીરાંગના દળના માધ્યમથી બેટી બચાવો આંદોલનના ભાગરૂપે એક વકૃત્વ સ્પર્ધા તથા બેટી ફોક પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જયપુરનાં માલવીયા નગર સ્થિત વીરાંગના દળનાં રાષ્ટ્રીય કાર્યાલય ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દળની રાષ્ટ્રીય અધ્યક્ષા સુશ્રી અનામિકા શર્માએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે કાર્યક્રમની શરુઆત યજ્ઞ, વૈદિક મંત્રોચ્ચાર અને ગાયત્રી પાઠના માધ્યમથી કરવામાં આવી હતી. શહેરની અનેક મહિલાઓ તથા યુવતિઓએ આમાં ભાગ લીધો હતો. દળની સંરક્ષક શ્રીમતી દુર્ગા શર્માએ કહ્યું હતું કે બેટીની ઉપેક્ષા કરવી એટલે દેશના ૫૦ ટકા નાગરિકોની ઉપેક્ષા કરવા બરાબર છે. આ પ્રસંગે અતિથિ તરીકે ઉપસ્થિત શ્રી મુકુટ બિહારીજીએ કહ્યું હતું કે આત્માનું સ્વરૂપ એક જ છે એટલે સ્ત્રી-પુરુષમાં ભેદભાવ કરવો અવૈદિકતા છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા શ્રીમતી પ્રિયા અગ્રવાલે કરી હતી. કાર્યક્રમમાં બેટી બચાવો ઉપર સૌથી સારા વિચારો વ્યક્ત કરનાર તથા સૌથી સારું ફોક બનાવનારને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બેટીઓના મહત્વ ઉપર પ્રકાશ પાડતી એક લઘુ પ્રદર્શની પણ યોજવામાં આવી હતી. કાર્યક્રમનાં અંતમાં સુશ્રી અનામિકા શર્માએ સૌનો આભાર માન્યો હતો.

આણંદ ખાતે શિબિરનાં સમાપન પ્રસંગે વીરાંગનાઓ દ્વારા શૌર્ય પ્રદર્શન કરાયું




ચરોતર પ્રદેશ આર્યસમાજ, આણંદ ખાતે યોજાયેલ આર્ય વીરાંગના શિબિરનાં સમાપન પ્રસંગે વીરાંગનાઓ દ્વારા કરાટે તથા લાઠીના નિદર્શનની સાથે કોઈ ચપ્પુ કે બંદુક લઈને હુમલો કરવા આવે તો કેવી રીતે બચી શકાય તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાડોકાઈ કરાટેનો અભ્યાસ કરી રહેલી વીરાંગનાઓ દ્વારા સ્ટોન બ્રેકિંગનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. દિલ્હીથી આવેલા આર્યવીર દળના પ્રશિક્ષક શ્રી સત્યમજી આર્ય તથા તેમના ધર્મપત્નિ અને આર્ય વીરાંગના દળનાં પ્રશિક્ષિકા શ્રીમતી અભિલાષા આર્યાએ શિક્ષક તરીકે સેવાઓ પ્રદાન કરી હતી. સમાપન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજ્ય સભાના સાંસદ તથા આર્યસમાજનાં અંતરંગ સભ્ય શ્રી લાલશીભાઈ વડોદરીયા, આર્યસમાજનાં પ્રમુખ શ્રી કનકસિંહ વાઘેલા, મંત્રી આર્કિ. શ્રી અશોકભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, પુસ્તકાલય શ્રી રાજેન્દ્રસિંહ રાજ સહિત અનેક પદાધિકારીઓ ઉપરાંત અગ્નિપથનાં માનદ્ તંત્રી શ્રી અરવિંદભાઈ રાણા, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાનાં પ્રમુખ શ્રી રણજીતસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આર્યસમાજના અગ્રણી કેળવણીકાર અને દાનવીર શ્રી પ્રતાપસિંહ શૂરજી વલ્લભદાસનું ૯૯ વર્ષની પાકટ વયે દેહાવસાન થયું

આર્યસમાજના અગ્રણી નેતા, વિદ્વાન, કેળવણીકાર, દાનવીર, રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા શ્રી પ્રતાપસિંહ શૂરજી વલ્લભદાસનું મુંબઈ ખાતે ૯૯ વર્ષની પાકટ વયે ગત ૬ઠ્ઠી મે, ૨૦૧૭નાં રોજ દેહાવસાન થઈ ગયું. આપશ્રીના દાદા તેમજ પિતાજી આર્ય વિચારધારા ધરાવનાર અગ્રણી વેપારી, ઉદ્યોગપતિ હતા, જેથી આપનું શિક્ષણ આર્યસમાજના સંતો, ઉપદેશકો તેમજ વિદ્વાનો દ્વારા મુંબઈની ઝાકઝમાળથી દૂર દેવલાલી તેમજ માથેરાનના પોતાના નિવાસસ્થાને થયેલ. શિક્ષણ અને સંસ્કાર સૌંભ ફેલાવતી પ્રવૃત્તિઓને દાન આપીને પોષી હતી. ઘાટકોપર ગુરુકુળને સવા લાખનું દાન આપ્યું હતું. માંડવી-કચ્છ ખાતે શૂરજી વલ્લભદાસ આર્ટ્સ અને કોમર્સ કોલેજ માટે રૂપિયા ત્રણ લાખનું દાન આપ્યું હતું. આર્યસમાજના ચિત્તોડગઢ ગુરુકુળ તથા એટા ગુરુકુળમાં યજ્ઞશાળા, ભોજનશાળા વાર્ષિક સહાયતા, છાત્રવૃત્તિ, સમાજના કમજોર નિરાધાર વર્ગને સહયોગ તેમજ અનેક સ્થાનોએ ધર્મશાળા, ભોજનાલય, સભાગૃહ, પુસ્તકાલય વગેરે માટે દાનની સરવાણી વહાવી હતી. વિલેપાર્લેમાં દિવંગત પિતાજીનાં સ્મરણમાં સાધના આશ્રમને વિકસાવ્યો હતો જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના કરકમળોથી કરવામાં આવ્યું હતું. સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા જે આર્યસમાજનું સર્વોચ્ચ સંગઠન છે તેના પ્રમુખ પદે ૧૨ વર્ષ સુધી રહ્યાં હતા. તેમના

કાર્યકાળ દરમ્યાન મોરેશિસ તેમજ દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલન યોજાયા હતા. મોરેશિયસના સંમેલનમાં ૧૦૦૦ પ્રતિનિધિઓને સમુદ્રી જહાજ દ્વારા લઈ જવાનો પ્રબંધ કરેલ. વેદભાષ્ય તેમજ અન્ય અપ્રાપ્ય ગ્રન્થોનું પુનઃ સર્જન તથા પ્રકાશન પણ સંપન્ન કરાવેલ. ૮૦ થી વધુ સામાજિક, વ્યવસાયિક ટ્રસ્ટો તેમજ સંસ્થાઓને તેમની સકીય સેવાઓ મળતી હતી. સન ૨૦૦૮માં આર્યવન,



સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા જે આર્ય સમાજનું સર્વોચ્ચ સંગઠન છે તેના પ્રમુખ પદે ૧૨ વર્ષ સુધી રહ્યાં હતા.

રોજડ ખાતે વાનપ્રસ્થ સાધક આશ્રમમાં યાજ્ઞિક પરિવાર સંમેલનના અતિથિ વિશેષ તરીકે તેઓ પધાર્યા હતા. તેમના પરિવારમાં છેલ્લા ૧૨૫ વર્ષથી દૈનિક અગ્નિહોત્ર થતો હોઈ તેમને પણ સ્મૃતિ ચિહ્ન તેમજ પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આર્યસમાજનાં અગ્રણી સંન્યાસીઓ તેમજ વિદ્વાનોની અતિથિ સેવાની તેમજ રોગી સુશ્રુષાની પરંપરાનો નિર્વાહ પણ તેમણે નિષ્ઠાપૂર્વક કર્યો હતો. ગૌરક્ષા કાજે તેમણે સર્વદલીય ગૌરક્ષા અભિયાન આરંભ્યું હતું. તેમના અદ્ભૂત નેતૃત્વ અને સંગઠનશક્તિ દ્વારા લાખો નર-નારી સત્યાગ્રહી બનીને જેલ યાત્રા કરવા સહર્ષ ઉદ્યત થયાં. આ વિશાળ આંદોલનથી વિવશ થઈ કેન્દ્ર સરકારને ઝૂકવું પડ્યું અને સમાનવાનરૂપે ભારતના અનેક પ્રાંતોમાં ગૌહત્યા બંધનો કાયદો અમલમાં આવ્યો. એ જ રીતે વડા પ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીનાં કાર્યકાળમાં મુંબઈ ખાતે ખ્રિસ્તી ધર્મના વડા પોપ દ્વારા વિશાળ સ્તર ઉપર ધર્મતરણ કરાવવા એક યુગેરીસ્ટિક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. ગરીબ વર્ગને વચ્ચે, અનાજ વગેરે સહાયતાના ઓઠાતળે ખ્રિસ્તી (અનુસંધાન પાન-૩ ઉપર)